

PHONES:

220228/230068

MO: 9428518890/9624630068

E-mail : dptco123@gmail.com

Website: <https://dpthakker.com/>



D. P. THAKKER & CO.

D. P. THAKKER & BROS.

TAX ADVOCATES

SHREE KUNJ, STATION ROAD,
PATAN (N.G.)

તા. ૨૩-૦૪ ૨૦૨૫

ભાઈશ્રી,

તા. ૦૧-૦૪-૨૦૨૫ થી TDS ની જોગવાઈઓ માં જે ફેરફાર થયેલ છે. તેની માહિતી નીચે મુજબ છે.

સેક્શન	ચુકવણીનો પ્રકાર	TDS કરવાની જૂની થ્રેશોલ્ડ લીમિટ	TDS કરવાની નવી થ્રેશોલ્ડ લીમિટ	TDS નો દર
194	ડીવીડંડ	5000	10000	10%
194A	પ્રાઈવેટ પાર્ટી વ્યાજ ચુકવે તેના ઉપર..	5000	10000	10%
	બેંક સીનીયર સીટીજનને વ્યાજ ચુકવે ત્યારે.	50000	100000	10%
	બેંક સીનીયર સીટીજન સીવાય વ્યાજ ચુકવે ત્યારે ..	40000	50000	10%
194C	કોન્ટ્રાક્ટ/લેબર/એડવર્ટાઈઝીંગ TDS	30000/100000	કોઈ ફેરફાર નથી	1%/2%
194H	કમીશન/બ્રોકરેજ	15000	20000	2%
194I	પ્લાન્ટ & મશીનરી	240000	માસીક રૂ.50000	2%
	જમીન/મકાન/ફર્નીચર	240000	માસીક રૂ.50000	10%
194J	પ્રોફેશનલ ફી	30000	50000	10%
	ટેકનીકલ ફી	30000	50000	2%
194T	ભાગીદારો ને આપાતા પગાર તથા વ્યાજ ઉપર	નવી જોગવાઈ	20000	10%

ઉપર લખ્યા મુજબ થ્રેશોલ્ડ લિમિટ કરતા વધારે રકમનું પેમેન્ટ કરવામાં આવે ત્યારે લાગુ પડતા દરે TDS કરવી પડે.

એટલે ચાલુ નાણાકીય વર્ષમાં TDS કરવા માટે નવી થ્રેશોલ્ડ લિમિટ ને ધ્યાન માં રાખી ને TDS કરવી.

કોઈ વેપારીનું પાછલા વર્ષનું ટર્નઓવર રૂ. 10 કરોડ થી વધુ હોય તેવા વેપારી વર્ષ દરમિયાન કોઈને રૂ. ૫૦ લાખથી વધુ રકમનું વેચાણ કરે અને સામેનો ખરીદનાર વેપારી જો કલમ 194Q પ્રમાણે TDS ન કરે તો વેચનાર વેપારી એ 0.10% પ્રમાણે TCS કરવી પડતી હતી. તે જોગવાઈ તા. ૦૧-૦૪-૨૦૨૫ થી દૂર કરી છે. એટલે હવે આવા કેસમાં વેચનાર વેપારીએ TCS કરવાની રહેતી નથી.

ઉપરની માહિતી અંગે કોઈ સ્પષ્ટતાની જરૂર હોય તો અમારો રૂબરૂ સંપર્ક કરવો.

કુશળ હશે

લી.

ધીરુભાઈ - કનુભાઈ

પીયુષભાઈ-નિખીલભાઈ

D.P. THAKKER & CO.